
	<p>મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ સરદાર પટેલ વિદ્યુત ભવન, રેસકોર્સ, વડોદરા -૩૯૦૦૦૭.</p> <p>CIN : U40102GJ2003SGC042907 ફેકસ નં. (૦૨૬૫) ૨૩૩૭૯૧૮, ૨૩૩૮૧૬૪ ફોન નં. (૦૨૬૫) ૨૩૧૦૫૮૩ થી ૮૬ ઈમેઇલ : cetech.mgvcl@gebmail.com ઈમેઇલ : ceproj.mgvcl@gebmail.com</p>	
---	---	---

રાજ્યના ગરીબ તેમજ બીપીએલ લાભાર્થીઓના ઉત્કર્ષ માટે ઘર વપરાશના વીજજોડાણો વીના મુલ્યે આપવા રાજ્ય સરકારશ્રી ધ્વારા અનુસુચિત જાતિ પેટાયોજના અંતર્ગત નાંણાકીય સહાય ગ્રાન્ટ રૂપે ફાળવવામાં આવે છે.

❖ અનુસુચિત જાતિ પેટા યોજના હેઠળ અનુસુચિત જાતિના વિસ્તારોમાં ઘરવપરાશ નાં વીજજોડાણ અંગેની રૂપરેખા :

૧. અનુસુચિત જાતિ પેટા યોજના હેઠળ અનુસુચિત જાતિના વિસ્તારોમાં વીજળીકરણ શહેરી તેમજ ગ્રામ્ય એમ બંને વિસ્તારોને લાગુ પડે છે. રાજ્યના સમગ્ર અનુસુચિત જાતિના વિસ્તારોમાં આવેલ અનુસુચિત જાતિના ગરીબ કુટુંબોને નિ:શુલ્ક ઘરવપરાશનું વિજજોડાણ આપવામાં આવે છે.
૨. અનુસુચિત જાતિના વિસ્તારો કે જે વિસ્તારોનું વિજળીકરણ ફક્ત હળવા દબાણની લાઇનથી કરવાનું શક્ય હોય તે વિસ્તાર માટે ઉભી કરવી પડતી વીજરેખાનો પૂરેપૂરો ખર્ચ આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે.
૩. ઇન્દીરા આવાસ, ઇન્દીરાનગર, ૧૦૦ ચોરસવારના પ્લોટ કે મફત પ્લોટ કે આવી નવી વસાહતો કે જ્યાં અનુસુચિત જાતિના લોકોની વસ્તી તે વિસ્તારની કુલ વસ્તી કરતા ૪૦ ટકા કે તેથી વધુ હોય તેવા વિસ્તારને આ યોજનામાં આવરી લેવામાં આવે છે.
૪. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના આવા વીજળીકરણ માટે ઉભી કરવી પડતી ભારે/હળવા દબાણની લાઇન અને વીજ વિતરણ કેન્દ્રનો ખર્ચ પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે. પરંતુ ટ્રાન્સફોર્મર સેન્ટર ઉભું કરવા માટે ૨૦ કે તેથી વધુ લાભાર્થીઓની માંગણી હોવી જરૂરી છે. જે પૈકી ૪૦ ટકા લાભાર્થીઓ અનુ.જાતિના હોવા જરૂરી છે.
૫. સદર યોજના હેઠળ નોંધણી ફી, ટેસ્ટર રીપોર્ટની ફી તથા વીજબીલ અનામતની રકમ લાભાર્થી પાસેથી વસુલવામાં આવતી નથી.
૬. લાભાર્થીએ સમાજ કલ્યાણ વિભાગ મારફત અથવા વ્યક્તિગત કિસ્સામાં સમાજ કલ્યાણ વિભાગ પાસેથી જાતિ અંગેનું પ્રમાણપત્ર મેળવી અરજી કરવાની રહેશે.

વર્ષ ૨૦૧૬-૧૭ માં ૫૦૦ ઘરવપરાશના વીજ જોડાણો આપવાનું આયોજન છે.